

www.arvind.com

3rd July, 2023

To,

BSE Ltd. Listing Dept. / Dept. of Corporate Services Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001

Security Code : 500 101 Security ID : ARVIND

Τo,

National Stock Exchange of India Ltd.

Listing Dept., Exchange Plaza, 5th Floor Plot No. C/1, G. Block Bandra-Kurla Complex Bandra (E) Mumbai - 400 051

Symbol : ARVIND

Dear Sir/Madam,

Sub: Submission of newspaper advertisement. Ref: Annual General Meeting of the Company to be held on Saturday, 5th August, 2023.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 3rd July, 2023 in the Financial Express (English & Gujarati) informing the shareholders for updating their email addresses in the records of the Company/ Depositories in compliance with the General Circular No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs (MCA).

Kindly take the same on your records.

Thanking You

Yours faithfully, For, Arvind Limited

R.V. Bhimani Company Secretary

Encl.: As above

Arvind Limited, Naroda Road, Ahmedabad. 380 025, India Tel.: +91 79 68268000 CIN: L17119GJ1931PLC000093

FINANCIAL EXPRESS

How IIT-B secured a spot in the top 150

NINA MUKHERJI

IN A SIGNIFICANT milestone for Indian highereducation, the Indian Institute of Technology Bombay (IT-B) has secured a place in the top 15 Olist of the QS World University Rankingg (WUR). The achievement is a tes-timony to the institute's com-mitment to academic excel-lence, research expertise, and contributions to the global aca-demic landscape, say experts. This year, the QS Rankingg introduced three new indicators

This year, the QS kankings introduced three new indicators – sustainability, graduate employability, and interna-tional research collaboration – to reflect the evolving priorities of students and higher educa-tion institutions. Among these criteria, IIT-Bombay excelled in employment reputation and

continuous autoragical criteria, IIT-Bombay excelled in employment reputation and citation perfaculty. Namita Mehta, president, The Red Pen, redits IIT's collab-orations with various presti-gious institutions – MIT, Stan-ford, China's Tsinghua University: Technical University of Denmark, Google, and Microsoft – Gritsinternational success. "Furthermore, director Prof. Subhasis Chaudhuri's recent visit to meet alumni membersin the US secured sub-stantial pledges exceeding v50 membersin the US secured sub-stantial pledges exceeding F30 core, and Infosys co-founder Nandan Nilekani has also donated significantly to IIT-8. These large endowments will support various initiatives, including scholarships, faculty chairs, and research projects" According to Simona Biz-zoero, communication director at QS (Quacquarelli Symonds), IIT-8 has shown a modest yet sustained focus on improving its research and global reputa-

its research and global reputa tion among academics and employers. "Notably, in five

OCCL

ORIENTAL CARBON & CHEMICALS LIMITED

prporate Identity Number (CIN) - L24297GJ1978PLC13384t Regd. Off. Plot No. 30-33, Survey No. 77, Nishant Park, Nana Kapaya, Mundra, Kachchh, Gujarat-370415


NOTICE OF THE 43RD ANNUAL GENERAL MEETING

Email investor/eedbackgoccimiaa.com; Weetsleir, www.occimiaa.com NOTICE OF THE 43RD ANNUAL GENERAL MEETING (ACM) of the Members of the Company will be held on Thurdsdy, the July 27, 2023 at 10.30 a.m. 15't through Video Conferencing (*CC') / Other Audio Visual Means (*OAM)" (activity in compliance with the applicable provisions of the Company will be held on Thurdsdy, the July 27, 2023 at 10.30 a.m. 15't through Video Conferencing (*CC') / Other Audio Visual Means (*OAM)" (activity in compliance with the applicable provisions of the Companies Act, 2013, Rules framed thereunder and the SEBI (Listing Obligations and DiscOsure Requirements) Regulations, 2015 read with Ministry of Corporate Aflains (*MCA'), wide General Cincular Nos. 2022, and 12:0022003, 02:2021, 19:2021, 21:2021, 02:2022, 10:2022 and 11:2022 dated Anil 8, 2020, April 13, 2020, May 5, 2020, 2 and Decomber 28, 2022 respectively (collectivity referred to as "MACA Circulars") and Circular Nos. SEBI/HO/CFD/CMD/10/18' P/2020/17' dated May 12, 2020, SEBI/HO/CFD/DD/20/18/70/224/ dated January 15, 2021, SEBI/HO/CFD/DD/20/18/70/224/ dated January 15, 2023, SEBI/HO/CFD/DD/20/18/70/224/ dated January 5, 2023, Saund hy the Securities and Exchange Boards of India (SEBI) (SEBI/SG)/CHD/20/21/11 dated January 15, 2023, SEBI/HO/CFD/DD/20/21/11/10/21/11 dated January 15, 2023, SEBI/HO/CFD/DD/20/21/11/10/21/11 dated January 15, 2023, SEBI/HO/CFD/DD/20/21/11/10/2

Final Divident for the year encide Match 31, 2023 (gr.s./r. Hoppes Seven only) per Eguity Share, to be declared at the 43rd AdAmual General Meeting of the Company: The Notice of the 43rd AdAm and the Annual Report of the Company including Financial Statements for the Financial Year encide March 31, 2023 (Annual General Transfer Agent, namely Link Infline India PAL Limited (TRIA) or with their respective Depository Participants (2004) (Depository), in accordance with the AdA (AdAM of the AdA (AdAM of the Company's Registrar and Share Transfer Agent, namely Link Infline India PAL Limited (TRIA) or with their respective Depository Participants (Company for Keightar and Share Transfer Agent, namely Link Infline India PAL Limited (TRIA) or with their respective Depository Participants (Company the AdAM of the Company and manner of participating through VCIOAM facility only. The instruction for joining the 43rd AdM of the Company and manner of participating through VCIOAM facility shall be counted for the purpose of reokoning the quorum under Section 103 of the Companing Act, 2013. The Notice of 43rd AdM and Annual Report of the Company for the Y 2022-23 with also be available on the Company is SEL to (SE) at www.beeindia.com and the websites of the Sidor Rechanges, namely, SEL to (SE) at www.beeindia.com and the website of the Sidor Rachanges, namely, SEL to (SE) at www.beeindia.com and the website of the Sidor Rachanges, namely, SEL to (SE) at www.beeindia.com and the website of the Sidor Rachanges, namely, SEL to (SE) at www.beeindia.com and NE at www.nesindia.com the participating through VCIOAM facility including extension by the signal address with the Company's RTA, can get the same registered and both Notice of the 43rd AdM of the Company for Youdy to Company's EMIS at the Company's EMIS at

 a signed request letter mentioning your Name, Folio Number and Complete Address, mobile number and email address to be registered; self attested scanned copy of the PAN Card;

QS WORLD UNIVERSITY RANKINGS 2024 Top 10 Indian universities on the list



- Massachusetts Institute of Technology (MIT)
 University of Cambridge
- University of Oxford
 Harvard University
- Stanford University
- Imperial College London
 ETH Zurich Swiss Federal Institute of Technology

- National University of Singapore (NUS)
 University College London (UCL)
 University of California, Berkeley (UCB)

excited to see IIT-B in the top 150 list! This global recognition should open the door for other premier institutions from India to enterfuture lists." Bizzozero suggested that Indian universities should focus on premeting global unagen

years, they have moved their employerreputation rank from 102 to 69 and their citations per faculty rank from 226 to 133. Foraverage citations perfaculty, they si at nearby four times the global median—an impressive fastby any standard, a sure sign that their research is having a real impact on the global stage," Bizzozero said. The recomption has heen Indian universities should focus on promoting global engage-ment, improving student-fac-ulty ratios, and increasing research influence to improve their rankings. She said that Anna University, the highest-ranked Indian university in the international research network Bizzozero said. The recognition has been well-received by employers. Srishti Sofat, senior vice presiranked Indian university in the international research network indicator, is only ranked 427th globally, while Amrita Vishwa Vidyapeetham, the top per-former in the international fac-ulty ratio metric, is 438th. dent of product development a Oracle, said, "It's overdue ent at

Key Dates: Tender publis

ast date of bid submission echnical Bid opening date

EXPLAINER THE NRF PUSH TO RESEARCH IN INDIA

The Cabinet approved the National Research Foundation (NRF) Bill last week. The aim is to give a massive fillip to research in the country. India has been lagging in R&D expenditure even as China has deployed substantial public funds for research at its top 100 higher education institutions. Sarthak Ray examines the backdrop in

which the NRF will come up and what it can achieve.

India's R&D landscape

THE COUNTRY'S R&D expenditure is not just much lower than other countries — 0.7% of the GDP vis-a-vis China's 2.1%, the US's 2.8%, Israel's 4,9%, and South Kore's 4.2% – it has also fallen over the years; in 2008, it stood at 0.85%. Indeed, the world average stands at 1.8%. The low speending manifests itself in both low research output. India has 255 researchers per million, compared to low research output. India has 255 researchers per million, compared to but US's 4,341 and Japan's 5,304. And, as per data from the World Intellectual Property Organisation (WIPO), though India saw a higher filing of patent applications at 61,373 than Germany's 58,509 in 2021 (the latest such data available). It was a THE COUNTRY'S R&D expenditure is

latest such data available), it was a on of China's 1.585.663. the US's 591.473, and Japan's 289.200

Administration and funding

Administration and funding THE DEPARTMENTOF science and technology will serve as the administrative department for NRF, though the foundation's scope will extend to promoting research outside natural sciences as well (for instance, in social sciences). It will be governed by a board that will comprise eminent researchers and professionals across disciplines.



NRF's goals

₹50,000 cr

R FIVE YEARS TO UP THE NATIONA

RESEARCH FOUNDATION

INDIA'S R&D SPEND, COMPARED WITH CHINA

2.1% AND THE US'S 2.8%

RESEARCHER POPULATIO

61,573

PATENT FILINGS IN INDIA V 1,585, 663 IN CHINA (2021)

THE GOVERNMENT ENVISAGES NRF as the apex body to provide high-level strategic direction to scientific research in the

apex body to provide high-level strategic direction to scientific research in the country as per recommendations of the National Education Policy. The foundation will foster collaborations between industry, academia, government departments and research institutions. It will also be responsible for setting up an interface between industries and state governments and immemoria taking "focus on creating a policy framework and putting in place regulatory processes that can encourage collaboration and increased spending by the industry on R&D". As per the detailed project report for NRF, the foundation will fund competitive peer-reviewed research proposals across disciplines, including inter-disciplinary research and research infrastructure, and work on building research capacity in the country.

estimated cost of ₹50,000 crore over five years (2023-2028). The detailed project report said the foundation will be given an annu grant that will eventually aim to reach 0.1% of the GDP (₹27,000 crore in current terms). The India Express reported that ₹36,000 crore of the ₹30,000 crore over 2023-2028 is expected to come

Building research capacity NRF WILL HARNESS the talent of outstanding serving and retired researchers to mentor and foster research at state and other universities and colleges where research needs to be germinated or is at a nascent stage. There will be grants to universities for research proposals as well as infrastructure. NRF will also launch a system of doctoral system of doctoral and post-doctoral fellowships to encourage more talented young people to join the research workforce, with a focus on under-represented groups. NRF fellows will be eligible to apply for enhancement to their eflowships. It will support researchers in

researchers in international collaborations and attending workshops. It will also facilitate mega-scale research with various interests, including to serve national goals such as eradication of malaria, eradication of malaria, cleaning up of rivers and clean energy, and international collaborative research such LIGO.

from industry and, in future, research projects will be funded in a 50:50 manner by the government and industry. The NRF will have the autonomy to set its own financial/ governance statutes. Any unspent funds in the initial years will be held as a corpus for NRF, to be managed professionally for steady, risk-free return.

The government has said that since the scope of the NRF-will be wide-ranging and would impact all ministries, the prime minister will serve as the exofficio president of the board and the ministers of science and technology and education will serve as the exofficio vice-presidents. The NRF-will be set up at an ALE OF ASSETS OF SNNEHA NATURAL PRIVATE LIMITED (in Liquidation) PRIVATE LIMITED (in Liquidation) Liquidation 21104 Provideali Read. Of Sa ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED (A. Govi. of Assam Public Limited Company) ISMT Limited PRIVATE LIMITED (IN LING) at Plot No. 18, Sector I, Phase III. Gat No. 50, Indi Estate L10, Yadrav, Ichaikaranji, Kolina d. Off. At : Fit 26-A. 1st Fit. A.3. Narayan P Char Sakigaka. Mumbai 400072, MH, Regd. Office : Panama House, Viman Nagar, Pune – 41101. Phone: 020-41434100 Fax: 1200-26630779 E-mail : secretarial@ismt.co.in CIN:L27109PN1999PLC016417 NOTICE NOTICE INVITING TENDER FOR APPOINTMENT OF AN A FOR PROVIDING SMS GATEWAY SERVICES TO APD E-mail: secretarial@jent.co.in Webbis: www.ismt.co.in Chr.21(196/WH196/WH2) PMCCE NOTCE is hereby given that 25 -manual General Meeting (AGM) of ISMT Ltd. (Company) will be held on Thursday, July 27, 2023 at 11.00 A.M. through Vebro in compliance with the adjoint of the company and adjoint of the Company and the Act 2013 read with General Circular No. 202020 A 10/2022 at: May 5, 2020 & December 28, 2020; re-spectively issued by the Ministy of Company and Section 24, 2013 read with General Circular No. 202020 A 10/2022 at: May 5, 2020 & December 28, 2020; re-spectively issued by the Ministy of Company and Section 24, 2013 read with the Company, Member 30, Pman 24, 2014 The Action 24, 2016 A January 5, 2023, the requirement of displasming physical cologies of the Notice of ACM. Analysis of the Advoint and Ministra Ministra Ministra 2016 and the Notice of ACM. Analysis of the Advoint and Ministra Ministra Ministra 2016 and the Notice of ACM. Analysis of the Advoint and Ministra Ministra Ministra 2016 and the Advoint of Advoint Advoint Advoint and the Advoint and Ministra Ministra Ministra integrational Banesis in Physical Company at animistra intigRightmetic.com of to the Company of sectional Company at animistra intigRightmetic.com of to the Company is at section of email D. Monile number & Advance deals. Annual Report Advance is available on the Company is sevenite www.istint.co.in, Stock Exchanges webbels www.bendina.com 3 & an Central Deportery Services to pacificaptier I Rother for updation of email D. Monile number & Advance deals (CMS Windle Minister Mini (Sale under Insolvency and Bankruptcy Code, 2016) iquidator of Snneha Natural World Private Limited (In Liqu anoninted by the Hon'ble NCLT, Mumbai, vide order dated 28.07 2021 NOTICE n "as is where is basis", "as is wh ssis". Sale will be done by the und Sovernance Services Ltd (NeSL) (w documents along with all relevant information will be available at http://assamtenders.gov.in. Tender processing fees: Rs. 20,000 00 (Rupees Twenty Tho Earnest Money Deposit: Rs. 25 00.000 00 (Rupees Twenty-It Date and Time of E-auction Thursday, 3rd August, 2023- 3 PM to 5 PM Last Date and Time for submission of EOI Up to Saturday, 22nd July, 2023 by 5 PM shing and download start date 03.07.2023 (17:00 ing date 07.07.2023 (12:00 ion start date 17.07.2023 (14:00 etc. by the Prospective bidder, aration of Qualified Bidder(s) ne for Inspection/due diligence Up to Monday, 24th July, 2023 Up to Tuesday, 1st August, 20 17.07.2023 (12:00 Hours 17.07.2023 (14:00 Hours 23 Iwith one-da prior intimation to Mr. Mob. - 9821916190) (Except Support Please pay your energy bill on time and help us to se Holdays)] Up to Tuesday, 1st August, 2023 by 03.00 PM est Money Deposit (EMD) Reserve EMD (5% of Price (Rs. Reserve Price in lakhs) (Rs. in lakhs) Sr. No. G2 Description (Assets) 828 41.40 av, Gut No. 50,51,52 Shiro, unaverse structure approximate built-up area 46,246,50 Sq. FL situated at Plot No. 1-B and 1 Village-Yadray, Gat No. 50,51,52 and 53, Panvati unaverse structure for the structure of the omlact through Email: <u>azventhanse@nesis.on</u>, <u>issupport@nesic.on</u> <u>dignesic.on</u>; or write to the undersigned at <u>granehavotid@granel.or</u> eventhan SE +91-9384076700, Mr. Neel Doshi +91-9404000667 or o ndey Mob. No. 491-9621916190. a absolute right to accept or reject any or all offer(s) bibls a backnoton or withdraw any recent or reject any or all offer(s) bibls. ing at any stage. Ravindra Chatura Liquidator of Snneha Natural World Private Limited (In Liquidat IBBI Regn. No.: IBBI/IPA.BN18P.D017027017.20101 For ISMT Lin Chetan Nat Company Secre Place : Pune Date : July 03, 2023 ARVIND LIMITED \rvind CIN - L17119GJ1931PLC000093 Regd. Office: Naroda Road, Ahmedabad - 380025 Website: www.arvind.com Email: investor@arvind.in Tel.: +9179 68268000-8108-09 NOTICE FOR ATTENTION OF SHAREHOLDERS OF THE COMPANY Pursuant to the General Circular No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Aflairs (MCA) and 2/PC/R/2023/4 dated January 5, 2023 issued by the SEBI (hereinalter collectively referred to as "circulars") companies are allow famual General Meeting (httough Viceo Conferencing) Other Audio Visual Meens (VCIAAM) and relaxed cottain provisions Report. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Require ("Listing Regulations") and MCA Circulars, the forthcoming AGM of the Company will be held on Saturday, 5th August, 2023 at 11:00 A. M. throug VC/OAVM to transact the business that will be set forth in the Notice of the meeting. The Registered Office of the Company shall be the deemed venu VC/CAMM to transact the business that will be set torth in the rocuce or use interveng. The suggester that we also allowed the Company to dispense with the requirement of dispatching the physical copies of Notice of the AGM an Annual Report. Accordingly, the same will be sent only in electronic mode to the members whose email addresses are registered with the Registra and Transfer Agents or with the Depository Participant(s). The Notice of the AGM and Stock Exchange of India Limited at Works email addresses are registered with the Registra and Transfer Agents or with the Depository Participant(s). The Notice of the AGM and National Report will also contains the instructions for casing- volta through remote www.neivind.com, website of the AGM and National Stock Exchange of India Limited at Www.besindia.com an www.neivind.com respectively and on the website of the NSDL at https://www.eveindin.add.com. yourse no unameasuresses verini visione, a meri influenze inter fution with instructions mentioned below. //sit the link: https://web.linkintime.co.in/EmailReg/Email_Register.html and follow the registration process as guided therein The members are requested to provide details such as Name, Folio Number, Certificate number, PAN, mobile number and e nal address. Physica Holding Demat

Pranab Kumar Maity Company Secretary & GM Legal



भारतीय रिजर्व बैंक भारतीय रिज़वे बैक RESERVE BANK OF INDIA Azadi Ka

Sr. No.	State/Union Territory	Amount to be raised (?cr)	Additional borrowing (Green Shoe) option (7 cr)	Tenure (in years)	Type of auction
1		1000	2	11	Yield based
	Andhra Pradesh	1000	5	16	Yield based
	-	1000	×.	20	Yield bases
2	Assam	1000	. š.,	10	Yield based
3	Himachal Pradesh	500		10	Yield based
		500		15	Yield bases
4.	Kerala	2000		19	Yield bases
5	Meghalaya	200	81	8	Yield based
6.	Punjab	500	a ()	11	Yield based
		500	-	25	Yield based
z	Rajasthan	1000		10	Yield based
		1000	5	25	Yield based
8.	Tamil Nadu	2000	8	10	Yield based
		2000	10	20	Yield based
9	Telangana	1000		18	Yield based
		1000	8	27	Yield based
	Total	16,200			

te right to reject any or all the tenders to www.tenderwizard.com/CCIL.

Sr. No.	State/Union Territory	Amount to be raised (?cr)	Additional borrowing (Green Shoe) option (? cr)	Tenure (in years)	Type of auction
	Andhra Pradesh	1000	2	11	Yield based
1		1000	5	16	Yield based
		1000	ж.)	20	Yield based
2	Assam	1000		10	Yield based
3	10 11 10 10 1	500	-	10	Yield based
3.	Himachal Pradesh	500		15	Yield based
4.	Kerala	2000		19	Yield based
5	Meghalaya	200	8	8	Yield based
6	Punjab	500	24 (j	11	Yield based
w.		500	-	25	Yield based
7	Rajasthan	1000	. 8	10	Yield based
- <i>t</i> c		1000	5	25	Yield based
8	Tamil Nadu	2000	8	10	Yield based
2		2000	10	20	Yield based
9	Telangana	1000		18	Yield based
		1000	8	27	Yield based
	Total	16,200			

"Don't get cheated by E-mails/SMSs/Calls promising you money."

Contact your Depository Participant (DP) and register your email address in your demat account as per the pro-communicated by your DP Holding ed for the information and benefit of the Members of the Company in compliance with the applicable circulars of MCA and SEBI

Date: 02.07.2023 By order of the Board R.V. Bhimar ace: Ahmedabad



Ahmedabad

Company Secretary

financialexp.epapr.in

Place : NOIDA Dated : 30.06.2023

c) self attested scanned copy of any document (such as Aadhar Card Driving License, Voter Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company. Members holding shares in dematerialized form are requested to update their email addresses with their respective Depositories. The afore-mentioned information is being scued for the information ane benefit of all the Members of the Company and is in compliance with the MCA Circulars and the SEBI Circular. For Oriental Carbon & Chemicals Limite

ફાયનાન્સિયલ એક્સપ્રેસ

Arvind

KERALA WATER AUTHORITY e-Tender Notice on of 25 MLD water treatment plant - Package 2 at Kumil on of 3.5 MLD plant at Marayoor EMD: Rs. 5,00,000/- & 1,00,0 : Rs. 16,540/- & 8,270/- Last Date for submitting Tender: 18-07 nitting Tender Superintending Engine KWA-JB-GL-6-593-2023-24 Muvattu

લઠી કરનાર, એક્સિસ બેંક લિ. ના			(1)]
યેલ કેંચ્જદાર / સક્કરજંદાર / ગીરવેઠ મદર નોટીસ ની તારીખથી દિન સાહ ડબલમાં જણાવેલ કરજદાર / સક્ક માં જણાવેલ બેંકની બાકી રકમની પરોક્ત કાયદાના સેક્શન ૧૩ (૪) ર 1વે ટેબલમાં ઉક્ષેખ કરેલ કરજદાર ને 1 રીતે થયેલ કોઈપણ વ્યવહાર તે નો) એકંટે, ૨૦૦૨ (ઉક્ત અધિ) 12 / જામીનદાર નીધે ટેબલમ (૬૦) માં ભરપાઇ કરી જવા ૧ જ્લાદ/ગીટદાર/જામીનદા ચૂકવણી કરવામાં કસૂરવાર નં સાથે ભિયમો પૈકી ભિયમ ૮ વંચ 'સક્કરજદાર/ગીરવેદાર / જ ટીસમાં જણાવ્યા મુજબ એકિ ગન્મ આદીલ રફેશે .	લાશોત. એ શિક્ષણીવાં પ્રેરેશન એન્ડ શૈકન્ડરકાન અંક કાલનાનિમારા એરેટ્સ એન્ડ એન્સોમેંગર અંગે સિક્ષણીટી ઇન્ટરેસ્ટ એકટ, ૨૦૦ ચિક્રામાં છે, તેમાં એન્સ માટે દાટાર અને ગોટીઓ વીસેપેત અનેને અને તથા માટે પ્રતાને સામાના થયે નોટીન આપવામાં આવે છે તે છે. તેમાં એન્સ માટે કે બીને પ્રેરાઓ તે તેમી એન્સ વિચેલની મિલ્લાનો અને પ્રેરાઓ છે. છે છે. તેમાં અને બીને એન્સ બેને પ્રેરાઓ તેમી અને વ્યવેલની મિલ્લાનો અને પ્રેરાઓ છે. એસ્સ એંક વિ. નીરે ટેબરનાં પણાવ્યા મુખ્ય ને બાક્સ દેશ ઉપરાંત આ દામ પાતું તેમ્ટ્રેસ્ટ્રાય અને દેશ વારે આગળનું વાય મહેત / મહેત / મ	તી નીચે ટેબલ ાકતર, ચાજી ! હેઠળ આપે ીચે સહી કરન વહાર કરવો ન
રાખેલ અસ્કચામતો આપેલા સમચગ	નાં છોડાવવા અંગે કરજદારોનું		
કરજદાર/જામીનદાર / સફ-કરજદારના નામ	ડિમાન્ડ નોટીસ તારીખ અને બાફી રકમ (બ્લાજ+ ચાજીસ -રીકવરી)	મલકતાના વચતા અચલિત મિલકતોની વિગતો	કબજાની તારીખ અને પ્રકા
(૧) નિતેશકુમાર નાનજીભાઈ અકબરી (૨) કરીબેન નિતેશકુમાર અકબરી	30-11-2018 / Rs. 24,26,858/- as on 24-11-2018	રદેશાંક બિલ્લીંગ ફરોટ નં. ૧૮૦ બાંધકામ જમીન સેઝફળ ૩૩.૮૪ રહે. મીટર્સ પ્લોટ નં. ૯ થી ૧૧ રેવેન્સુ અર્વે નં. ૯૭/ પીર રાજકોટ, ''લજવિલા કલેટ્સ' લાગે જ્યાંદી તુવજવિલા કલેટસ વિંગ – એક, કહેટ નં. ૧૦૮, વાલડી ગામ ગેટ રાજકો ની અચલિત મિલકલના બધા ભાગ અને ફિસ્ટા સાથે જે શ્રી નિસંશુધાર હાઇટ નં. એક–૧૦૯, પૂર્વ પેસેન, પશ્ચિમ: ખુદ્દા આકાશ	28-06-202 সংগঞ্জ
(૧) સમનસિંહ ભૂલાજી ઠાફર	07-12-2021	રહેણાંક ઘર નં. એ–૫૦, તેનો કુલ એરિયા ક્ષેત્રફળ ૧૧૨.૦૦ સ્કે. મીટર્સ બિલ્ડ અપ ક્ષેત્રફળ બ્રહ.કર સ્કે. મીટર્સ બીનખેતી જમીન ' વેવેન્ચ સર્વે નં. ૧૩૪૦ / ૧, મોજે – માણસા, ૨૪૦સ્ટેશન સબ જાણી અને ૨૪૦સ્ટેશન જાણી – ગાંધીનગર ની મિલકતના બધા ભાગ	30-06-202
	દર ગોટેલ થી વારીબથી દિન માહ હતમાં જણાવેલ સ્ટાર સ્ટાર સ્ટાર માં જણાવેલ બેંકની લાવી કરમની પોંડેલ કાયદલા કોઇપણ વ્યવણ રે સે ગેરે ટેલ્લમાં દીધેમ કરેલ કરપદાર, રોતે થયેલ કોઇપણ વ્યવણ રે સ્ટાનના બં પ્રચલ, સાયુંદ્ધ વગેરે દરમના બં પાંચેલ અસ્ક્રમાનો આપેલા સમગ્ર કરપદાર/જમીનદાર / સંક સ્ટેપદાર/જમીનદાર / સંક સ્ટેપદાર/જમીનદાર / સંક સ્ટેપદારના નામ કાર્યવાર (સ્ટ્રો કરીબેન નેરેલાયુમાર અકબરી	દર સેદીર લે તોનીમાં દી તે માંડ (૨૦) માં ભરાપારી કે પળ : આંગ સ્વાર્ગ સરકર : પ્રસ્તાર કે પ્રસ્તાર : : પ્રસ્તાર : : પ્રસ્તાર : : પ્રસ્તાર : : : : : : : : : : : : : : : : : : :	મારેલ સરકાયમાં ત્રાપ્તેલા સ્વચલે લીકલાય એ કે સુજરાતીનું સરીકી એકટ, ૨૦૦૨લા રેકાય પ ગતા કલ- રેકાય (૮) ની પોપાઈ તરક બાત દીરખાં મારે છે. સ્વરાય અન્યુજ્ય કે બેલું કે બે

અરવિંદ લીમીટેડ

SHIONI	NG POSSIBILITIES	૨જીસ્ટર્ડ ઓફીસ : નરોડા રોડ,	અમદાવાદ-૩૮૦૦૨૫		
	વેબસ	ાઇટ: <u>www.arvind.com</u> ઇમે	धवः <u>investor@arvind.in</u>		
		ફોન : +૯૧ ૭૯ ૬૮૨૬૮૦			
	કંપનીના	શેરહોલ્ડરોની જા	શકારી માટેની નોટીસ		
ર્પોરેટ અ	ફેર્સ મંત્રાલયે ("એમસીએ") દ્વારા જારી કરાયેલ વ	ત્નરલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૨	તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ અને સેબી દ્વારા જારી કરાયેલ SEBI/HO/CFD/P		
IP/CIR20234 તારીખ ધ જાન્યુઆરી, ૨૦૨૩ (સંયુક્ત રીતે "પરિપત્રો" તરીકે દર્શાવેલ છે) અન્યસે, કંપનીઓને વિડિયો કેન્ફરન્સીંગ/અન્ય ઓડિયો વિઝ્યુઆલ માધ્ટ રીસી/ઓએવીએમ) મારફત તેમની એગ્રુએમ યોજવાની પરવાની આપેલ છે અને વાર્ષિક અદેવાલ સર્બાદાત જોગવાછઓમાંથી મુક્તિ આપેલ છે.					
રિપત્રો અનુસાર કંપનીની આગામી એજીએમ શનિવાર, પ ઓગ્સ્ટ, ૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સભાની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે વીસી/ઓએવીર ારક્ત યોજાશે. કંપનીની સભાનું સ્થળ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ રહેશે એવું માનવું.					
			ા મોકલવાની પણ પરવાનગી આપેલ છે. તદ્દઅનુસાર જે તે સભ્ચોના ઇમેઇલ ર		
			ને ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમથી નોટીસ મોકલવામાં આવશે . એજીએમની નોટી		
			એજીએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.arvind.c</u>		
			લીમીટેડની વેબસાઇટો અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.</u>		
	મેસડીએલની વેબસાઇટ <u>https://www.evoting.</u>				
ધુમાં કંપન	ની / ડિપોઝિટરીમાં ઇમેઇલ એડ્રેસ સુધારવા / નોં	ધાવવા માટે, શેરહોલ્ડરો નીરો દ	ર્શાવેલ સુચનાઓ અનુસરી શકે છે :		
ફેઝીકલ	هُدهُ https://linkintime.co.in/EmailF	eg/email_register.html Ris	ની મુલાકાત લઇને તેમાં સુચવાયેલ ૨૭૮૨ટ્રેશન પ્રક્રિયા અનુસરવી. સભ્ર		
	નામ, ફોલિયો નંબર, સર્ટીફીકેટ	નંબર, પૅન, મોબાઇલ નંબર, ઇન્	ોઇલ એડ્રેસ જેવી વિગતો જણાવવા વિનંતી છે		
કેમેટ	તમારા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો	(ડીપી) સંપર્ક કરીને તમારા ડીપં	ો દ્વારા જણાવાયેલ પ્રક્રિયા અનુસરીને તમારા ડિમેટ એકાઉન્ટમાં તમારા ઇમેદ		
ક્રોલ્કીંગ	એડ્રેસ રગ્રસ્ટર કરવો		~		
મસીરકે ગ	ઝને સેબીના લાગુ પરિપત્રોના અનુપાલન હેઠળ	ຣຸ່ນດໃດແ ສາເໝັດໃຊແນລະວ່າ ວະ	ને લાભાર્થે આ નોટીસ જારી કરાઇ છે.		
			બોર્ડના હુદ		
ારીખ: ૦૨	. 00.2023		આર. વી. ભીં		
	EIGIE		કંપની સે		
યળ: અમ					
am: अभ	SUNDARAM MUTUAL		the Scheme Information Document (SID) and Key		
śſ	SUNDARAM MUTUAL	Information Mer	norandum (KIM) of Scheme of Sundaram Mutual Éunc		
SF Unithol	SUNDARAM MUTUAL	Information Mer of SEBI Circular no. SEB	norandum (KIM) of Scheme of Sundaram Mutual Éun /HO/MD/IMD-I POD2/P/CIR/2 dated March 29, 2023, relati		
Unithol to "Rev	SUNDARAM MUTUAL	Information Mer of SEBI Circular no. SEBI of mutual fund schemes	norandum (KIM) of Scheme of Sundaram Mutual Fun /HO/IMD/IMD-I POD2/P/CIR/2 dated March 29, 2023, relat investing Overseas", the below mentioned Scheme of Sundar.		
Unithol to "Rev Mutual	SUNDARAM MUTUAL iders are hereby informed that in terms we of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline	Information Mer of SEBI Circular no. SEBI of mutual fund schemes for declaration of NAV w	norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund /HO/MD/IMD-I POD2/P/CIR/2 dated March 29, 2023, relati investing Overseas", the below mentioned Scheme of Sundar .e.f. July 01, 2023.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEBI of mutual fund schemes for declaration of NAV w Existing Timeline	norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HOMMD/MD-I POD2/PCIR/2 dated March 29, 2023, relati investing Overseas", the below mentioned Scheme of Sundar c.e.f. July 01, 2023. New Timeline		
Unithol to "Rev Mutual	SUNDARAM MUTUAL iders are hereby informed that in terms we of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund VH:O/MD/MD-I POD2/PCIR/2 dated March 29, 2023, relati investing Overseas", the below mentioned Scheme of Sundar sc.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEBI of mutual fund schemes for declaration of NAV w Existing Timeline	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund M+O/MD/MD-I POD2/P/CIR2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundar set.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HCMMD/MD-1 POD2/P/CIR/2 dated March 29, 2023, relati Divesting Overseas", the below mentioned Scheme of Sundar (c, f, uly 01, 2023) New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to oversee. securities and have exposure as on date, thus the scheme		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HO/MDD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relati investing Oversess", the below mentioned Scheme of Sundar c.e.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the schem require extended timeline for NAV disclosure to ensure th		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fun (H-OMID/MD-1 POD2P/PCIR2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundar ket, July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HCMMD/MD-1 POD2/P/CIR/2 dated March 29, 2023, relati investing Overseas", the below mentioned Scheme of Sundars .e.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HCMMD/MD-1 PCD2/PCIR/2 dated March 29, 2023, relati investing Overseas", the below mentioned Scheme of Sundars (scf. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Marandum (KIM) of Scheme of Sundaram Mutual Fund MHOMMD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundars te.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HO/MDD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relating investing Oversease", the below mentioned Scheme of Sundara (e.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the schem require extended timeline for NAV disclosure to ensure the all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to ar overseas securities, NAV of the relevant schemes for th		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	Morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HO/MDD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relating investing Oversease", the below mentioned Scheme of Sundara (e.f. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the schem require extended timeline for NAV disclosure to ensure the all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to ar overseas securities, NAV of the relevant schemes for th		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund M-(OMD/DMD-1 POD2/P/CIR/2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundara text. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to ar overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on th following business day.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name	Information Mer of SEBI Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every	morandum (KIM) of Scheme of Sundaram Mutual Fund M-(OMD/DMD-1 POD2/P/CIR/2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundara text. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to ar overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on th following business day.		
Unithol to "Rev Mutual S. No. 1	SUNDARAM MUTUAL Ides are hereby informed that in terms were of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline Scheme Name Sundaram Services Fund	Information Met of SEBI Circular no. SEB of mutal fund schemes for declaration of NAV w Existing Timeline 11 PAN on every business day	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HOMD/MD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundars (sct. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse: securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light, the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to a overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on the following business day. Subsequent to that day, NAV of the relevant schemes sha be declared on 11.00 P.M., on the same day.		
Unithol to "Rev Mutual S. No.	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised imeline Scheme Name Sundaram Services Fund Sundaram Large Cap Fund	Information Met of SEB Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every business day 11 P.M on every	Network (KIM) of Scheme of Sundaram Mutual Funct MHOMMDIMD-1 POD2P/CIR2 dated March 29, 2023, relati Mixesting Overseas", the below mentioned Scheme of Sundara set. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse; securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to a overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 11.00 A.M on th following business day. It. Subsequent to that day, NAV of the relevant schemes sha be declared on 11.00 P.M., on the same day. It.00 P.M on every business day		
Unithol to "Rev Mutual S. No. 1	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms lev of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline Scheme Name Sundaram Services Fund Sundaram Large Cap Fund Sundaram Mid Cap Fund	Information Met of SEBI Circular no. SEB of mutal fund schemes for declaration of NAV w Existing Timeline 11 PAN on every business day	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HCM/MD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, retain investing Overseas", the below mentioned Scheme of Sundar cet. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse securities and have exposure as on date, thus the schem require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to a overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on the following business day. Subsequent to that day, NAV of the relevant schemes shu be declared on 11.00 P.M., on the same day. 11.00 P.M on every business day The schemes are permitted to take exposure to overses.		
Unithol to "Rev Mutual S. No. 1	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms iew of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline Scheme Name Sundaram Services Fund Sundaram Large Cap Fund Sundaram Mid Cap Fund Sundaram Mid Cap Fund	Information Met of SEB Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every business day 11 P.M on every	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HOMD/DMD-1 POD2/P/CIR2 dated March 29, 2023, relati investing Oversease", the below mentioned Scheme of Sundars (scl. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse. securities and have exposure as on date, thus the scheme require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to a overseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on th following business day. Subsequent to that day, NAV of the relevant schemes sha be declared on 11.00 P.M., on the same day. 11.00 P.M on every business day The schemes are permitted to take exposure to overse. securities. In such cases where the schemes have take		
Unithol to "Rev Mutual S. No. 1	SUNDARAM MUTUAL ders are hereby informed that in terms lev of time limit for disclosure of NAV Fund shall follow the revised timeline Scheme Name Sundaram Services Fund Sundaram Large Cap Fund Sundaram Mid Cap Fund	Information Met of SEB Circular no. SEB of mutual fund schemes for declaration of NAV w Existing Timeline 11 P.M on every business day 11 P.M on every	Norandum (KIM) of Scheme of Sundaram Mutual Fund (HCM/MD/MD-1 POD2/P/CIR2 dated March 29, 2023, retain investing Overseas", the below mentioned Scheme of Sundar cet. July 01, 2023. New Timeline 10.00 A.M. on the following business day. The schemes are permitted to take exposure to overse securities and have exposure as on date, thus the schem require extended timeline for NAV disclosure to ensure th all securities are valued basis same day valuation. In light the above, NAV of the schemes would be declared by 10.0 A.M. on the following business day. In case any of the scheme ceases to hold exposure to a voerseas securities, NAV of the relevant schemes for th day would continue to be declared on 10.00 A.M on the following business day. Subsequent to that day, NAV of the relevant schemes shu be declared on 11.00 P.M., on the same day. 11.00 P.M on every business day The schemes are permitted to take exposure to overses.		

business day. In case any of the schemes ceases to hold exposure to any undaram Flexi Cap Fund undaram Focused Fund Sundaram Dividend Yield Fund overseas securities, NAV of the relevant schemes for that Sundaram Consumption Fund Sundaram Infrastructure Advantage Fund Sundaram Financial Services day would continue to be declared on 10.00 A.M on the following business day. Subsequent to that day, NAV of the relevant scheme shall b Opportunities Fund declared on 11.00 P.M on the same day Sundaram Aggressive Hybrid Fund Sundaram Multi Cap Fund Series II

This addendum forms an integral part of the Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of the above mentioned Scheme of Sundaram Mutual Fund. unchange

An other contents remain unchanged.	
Place: Chennai Date: July 01, 2023	For Sundaram Asset Management Company Ltd R Ajith Kumar Secretary & Compliance Officer
For more information please contact: Sundaram Asset Management Company Ltd (Investment Manager to Sundaram Mutual Fund) CIN: U93090TN1996PLC034615	 1st & 2nd Floor, Sundaram Towers, 46, Whites Road, Royapettah, Chennai-14. Contact No. (India) 1860 425 7237, (NRI) +91 40 2345 2215 Fax: +91 44 2841 8108, www.sundarammutual.com No. 21, Patullos Road, Chennai 600 002.
	s, read all scheme related documents carefully. nance may or may not be sustained in future.

KERALA WATER AUTHORITY --Tender Notice PHC/TVLA (3)58/2023-24/KWA/ PHC/TVLA-(RT2) JJM-on and Commissioning of 8.5 MLD WTP and allied wo insformer etc. (2)CWSS to Chenneerkkara & Omalioor P ply IO IX VICE HTCs in Vechouse er fee: Rs. 13010, 1915 etenders.ker

(Formerly TITAGARH RAIL SYSTEMS LIMITED

(Formerly TITAGARH WAGONS LIMITED) CIN: L27320WB1997PLC084819 Registered Office: Titagarh Towers, 756 Anandapur, E.M Bypass, Kolkata 700107 Phome: (033) 40190802, Fax: (033) 40190823 Email: investors@titagarh.in, Website: www.titagarh.ii

THIRD CORRIGENDUM TO NOTICE OF EXTRA-ORDINARY GENERAI MEETING OF THE COMPANY'S MEMBERS, SCHEDULED ON TUESDAY, THE 4TH JULY, 2023

ON TUESDAY, THE 4TH JULY, 2023 Notice is hereby given that the Company has on July 01, 2023 despatche the Company is monitors, substitution of the starts of the July, 2023 desting the Company is monitors, substitution of the July, 2023 desting the Company is monitors, substitution of the July, 2023 desting and the Starts of the Starts of the Starts of the July, 2023 desting the Starts of the Starts of the Starts of the Company Act, 2013 and Rules made thereunder read with the circulars issued b MCA, to all the shareholders whose email addresses are registered with the Company, or the RTA or their respective DP. The EGN Notice was amended pursued by Company on June 24, 2023 (Scoold Compandum date June 23, 2023 issued by Company on June 24, 2023 (Scoold Compandum date June 23, 2023 issued by Company on June 24, 2023 (Scoold Compandum together referred to as "Previous Corrigendum".

together referred to as "Previous Comgendum". This Corrigendum to the Notice of EdM is available on website of both the Slock Exchanges i.e. BSE Limited and National Slock Exchange of India Limited and on the website of the Company at weblink https://titganh.inistorage/report/accual/ide229/drg/ad and the webside of NSDL at www.exchign.satic.com The shareholders and others concerned are requested to take note of the ahrow.

For Titagarh Rail Systems Limited (Formerly Titagarh Wagons Limited)

Dinesh Arya

ISMT Limited

E-mail : secretarial@ismt.co.in Website : www.ismt.co.in CIN:L27109PN1999PLC016417

NOTICE

e : Panama House, Viman Nagar, Pune -ine : 020-41434100 Fax : 020-26630779

Regd. Office :

CINEL2Y1000PH/030PE/CD/1617 NOTICE is hereby given that 25 years that the second seco

Allow we'- in the abilit common on service and the service of the

Chetan Nathani Company Secretary

Place : Kolkata Company Secretary & Chief Co Date : 1st July, 2023

Place : Pune Date : July 03, 2023 ી **જના સ્મોલ કાર્યનાન્સ બેંક** <u>રાશ્રરક પ્રોલીસ</u> ધ ફેરવે, ગાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં ૧૦/૧, ૧૫/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, (શિવ્યુલ્ક હોમાંસિલ બેંક) કોરમંગલા ઇનર રીંગ સેક, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, રાદાઘઢુા, બેંગ્લોર-પદ્૦૦૭૧. ^{શલ બક}) રીજનલ બ્રાન્શ એ જાયોલે દેવાદારો, સદ-દેવાદારો, જમીનદારો અને ગીર દેદારોએ **અના અપેલ કાયનાન્સ મંક લીમીટેક** પાસેથી તમારી સ્થાવર મિલકતોન યે તમારા લોન એકાઉન્ટ નોન-પરકોમીંગ એકેટ તરીકે લોકોનુ સચા છે, આથી **અના અપેલ કાયનાન્સ બે 6 તોમેટેક** ક્લિઝોડે લો તમારા તે અરુ નોનિયમ સાથે ભાષાલો એકાઈની કલમ સર્ક) ના લોકતે હઠા પાસ સાવતા પિયોન કરીને મોગ્યાને લોકે પાસેથાં તે કિશ્લો કેવાં ગુંબરોને _નોટીસની તારીબથી ૬૦ દિવસની અંદર નોટીસોમાં જશાવેલ રકમ તેના પરના સક્ત વ્યાજરાતી હવા છે. વાસે બે જ્યાં છે સ્થારે પ્લ .. ત્મ એક્ટ હેઠળ લમ નં. ૨ માં જણાવે વેનિલ્લ અન સક્યારાટા ઇન્ટ Iલ દેવાદારો/સહ–દેવાદ Iમાંશ્રી કેટલાકને નોટીસં કમ દેવાદાર / સહ-દેવાદાર/ લોન એકાઉન્ટ , બામીનદાર / મોર્ગેબ્ટનું નંબર અને બાહી રહ્ય ટાંચમાં લેવાનાર સિક્યોરીટીની વિગતો નંબર અને લોનની રકમ પ્રથા નોરીસની નારી રૂા. માં /ના રોજ મેનપીએ તારી : ૦૧/૦૬/૨૦૨ 31,92,00,338,28/-

ગીસે સ્થાવર મિલ્કત- અનુસૂચિત શિલકત- રચુરદેશન પ્રાપ્તા અને ઉપ-સુધા વડોદાસ અને ગ્રીથો સ્થાવર મિલ્કત- અનુસૂચિત શિલકત- રચુરદેશન પ્રાપ્તા અને ઉપ-સુધા વડોદાસ અને પ્રાપ્ત વડોદાસ અને ગ્રેખ બાદી વડોદાસ અને અનુ શર્ તે . ૨૦, ૨૫, ૨૦, ૨૫, ૨૦, ૧૫, ૨૦, ૧૫ વડોદાસ એટના ગ્રેપ ના ગ્રેપ ક્લેપ વડોદાસ અને પ્રાપ્ત કરતા કરતા છે. અંદરે કે દ્વારા તો દરે સે ગ્રેપ્ટ લાગે માંગાં સાથા પ્રાપ્ત કરતા કરતા છે. અંદરે કે દ્વારા તો દરે સે ગ્રેપ્ટ લાગે માંગાં સાથા માંગા અને નિટ્સ કરતા કરતા છે. ગોરે સાથર શિલકત- અનુસૂચિત મિલ્લ તા - ગુભાસ સે ગ્રેપ્યુ કર્ય તે . ૨૦, ના તો દરે સે ગ્રેપ્ટ બેગ બાદ કે ગ્રેપ્ટ બેગ બાદ બેગ અને ગ્રેપ્ટ સે ગ્રેપ્ટ બાદ વિદ્યારા તા આપ માંગા અને નિટ્સ . ગીરે સાથર શિલકત- અનુસૂચિત મિલ્લ તા - ગુભાસ સે ગ્રેપ્યુ કર્ય તે . ૨૦, ના તો દરે દાવા તો ૧૦૦૦ તો .ની. સે ગ્રેપ્ટલની ખુદ્દી ભગીનનો સાથવાર શિલકતના તમામ ભાગ ગ્રે બેટ્સ. લોન એકાઉન્ટ નંબ૨ \$518943000047 ૧) બંગકીવાલા (રૂપિયા બાર લાખ ગણસો સોત્રીસ અને સોવીસ પૈસા નંશીર મોર્ઘ ઝા નોટીસની તારીખ : નુસ્લસાર માછઝામાટ ૨) તસ્ત્રીમ બંગડીવા લોનની સ્ક્રમ 1. ૧૨,૮૮,૩*૭૭/*-પરા) ૧૮/૦૬/૨૦૨૩ મુજ :૧/૦૬/૨૦૨ નાગીએ તારી જે પ્લેટ પ્લેટ અને પ્લેટ કે પ **રૂા. ૧૩,૨૦,૪૫૯.૦૦/-**(રૂપિસા તેર લાખ વીસ હવ સારસો ઓગણપરસાસ પ્ર ૧) ચાવડા ભરતભા રાઘવભાઈ, ૨) ચાવ કિરણબેન ભરતભા ૦૧/૦૬/૨૦૨૩ નાંગણાં નોટીસ તારીખ : ભોન એકાઉન્ટ ગીચે સ્થાવરમિલકત - અનુવુદ્ધિત બિલત - સાચલા પંચાયતની હરમ, તાલુકા સાચલા, પ્ર ંચ્યું ગુન્મુનગર પાતે તેનો પરાળ છું. તેમું, ના બપ, ૧૧ મો.ગે. બિલ્ડામાં એકીલા સંક્રિય ૮૮૦૮ ૧ ગોચેક્વરેબાર પાત્રે અને બિલ્ડાસનો સાચલા પ્રધાવતા બિલ્ડન, ના સ્વાપ, ૧૬ મો.ગે. બિલ્ડામાં એકાવ્ય બિલ્ડા ૨૮૦૮ ૧ ગોચે આવતા કે બાલ્યા સરવામાં નિવાર બિલ્ડા પાંચ પ્રધાવના બિલ્ડન, દ્વિરાય, ગોચરાનભાઇ લું ૪,૮૦,૦૦૦ -ગોચે સાચાર બિલ્ડન - અનુવુધિત બિલ્ડન, પું પં ગે, પ્રધિમાં સ્વેક્ટ લોન ગોકાલીન્સ્ટ તેમ સ્વાપ્ય સરવામાં નિવાર બિલ્ડન, પું પં ગે, પ્રધાના સ્વેક ના સ્વાપ્ય સરવામાં નિવાર બિલ્ડન, પું પં ગે, પ્રધાના સ્વેક ના સ્વાપ્ય સરવામાં નિવાર બિલ્ડન, પું પં ગે, પ્રધાના સ્વેક તેમ સ્વાપ્ય સરવામાં બિલ્ડન, પું પં ગે, પ્રધાન સ્વેક, પ્રધાન કે ગે, સ્વિરાય કોર્યક્રોયના બિલ્ડના દ્વાર્ય ના સ્વાપ્ય સ્વેક ના કારુ-પત્રે સાં, તેમ તેમ સ્વેક બિલ્ડ બોર્ક સ્વર, ગું ફોક્સ સ્વાપ્ય બોર્યક્રેયના બિલ્ડ ચાલ્ય તેમ સ્વાપ્ય સ્વેક ના કારુ-પત્ર સાં, તેમ તેમું લોક બોલ્ડ સ્વર, ગું સુધાન પ્રધાય બોર્યક્રોય સાધે તેમ સ્વર ને કારુ-પત્ર સાં, તેમ તેમ સ્વેક બિલ્ડ સ્વર, ગું સાધાર બોલ્ડ ચાલ્ય પ્રધાય પ્રધાય પ્રધાર બોલ્ડ સાધ્ય પ્રધા પ્રધાર બોલ્ડ પ્રધાન સ્વર માં સાધ્ય સાધ્ય પ્રધા પ્રધાન સ્વર, પ્રધાર પ્રધા સાધ્ય વ્યવ્ય સાધા તેમ સ્વર તે સ્વર ને સાધ્ય બિલ્ડન સાધ્ય બાલ્ય પ્રધાન સ્વર તેમ સાધ્ય સાધ્ય બોલ્ડ સાધ્ય બિલ્ડ ગાય સ્વર બોલ્ડ પોર્ય સ્વર તે ત્વર (તે બોલ)ત. ૧૮/૦૬/૨૦૨૩ મુજબ ૱. ૨,૮૮,૯૩૯.૪૦/-૨૧/૦૬/૨૦૨૩ નપીએ તારી ૧) ડાભી ધીરૂભા ચ્રા ૨,૯,૯૩૯.૭૫/-(રૂપિશા બે લાખ ઈઠ્શાસી ઠંભર નવસો ઓગણસાલી; અને સાલીસ પૈસા પુરા) ૧૮/૦૬/૨૦૨૩ મુજબ : ૦૧/૦૬/૨૦૨ માંગણાં નોટીસની તારીખ : ૨૧/૦૬/૨૦૨: વિકુભાઈ, ૨) ડાભી કનુબેન ધીરૂભાઈ പ ૧) જ્યેશ રતિલ ાનપાએ તારણ ૦૧/૦૬/૨૦૨: માંગણાં નોટીસની તારીખ : રૂા. ૨૫,૧૩,૧૮૧.૦૦/-. જોટાણીચા, ૨) જોટાણીચા ૨માબે રતિલાલ (રૂપિસા પસ્સીસ લાખ તેર જાર એક્સો એક્સાસી પુર ૧૮/૦૬/૨૦૨૩ મુજ્બ 29/05/204 રાવે ને . હટ/ર નો અમેન. ગીસે સાયાર મિલાત – અનુસુધિત બિલાત – મેળે કોસમાડી, ઉપ ગ્રુ. અંકલેશાર, ભારૂથના કર્યને . હરુપા ને લેશિયન હાઉટ્સમાં વરુ પડ મો... લા હારદે સાથે બાનિ વિસાર સૌધી બિલાડી ગે અને ના આ માળે કરુ ર સુધી ગો... કારોટ સેલીસા, ૧૯૦. ૩૨ સો..મે.. લિલ્ટ સાથ અને સિસાર સૌદીમાં વું લેટ ને . તે બેટના તે લોળ તે લોળ તે લોળ તે લાગ બેલા કરે ના બેલા કરે તે કારો છે. વું લેટ ને . તે બેટના તે લોળ તે લોળ તે લોળ તે કારો છે. તે લોળ તે લોળ તે બાને સિસાર સૌદીમાં પુર્વ : તે લે .. તે બેટના સ્વાર અને એ/તરુ, પશ્ચિમ: સેડ, ઉત્તર: સોસાથદી પાર્ટિંગ, દરીધરા સૌસાથદી શેઠ. **રૂા. ૫૧,૩૯,૧૧૭.૪૮/–** (રૂપિસા એક્કાલન લાખ ઓગણસાલીસ દંજાર એક્ટ સારર અને અડ્તાલીસ પૈસ પુરા) ૧૮/૦૬/૨૦૨૩ મુજબ લોન એકાઉન્ટ નપીએ તાર ૧) જીંદલ મંગલભ ૦૧/૦૬/૨૦૨ માંગણાં નોટીસની તારીખ 1519610 લુહ્વાર, ૨) શાલીનબે મંગલભાઈ લુહ્વાર લોનની ૨કમ 1. ૫૦,૦૦,૦૦૦/-લારાખ : ૨૧/૦૬/૨૦૨: લોન એકાઉન્ટ નંબર 4525942000105 ાનપીએ તારી **રૂા. ૫,૩૦,૬૦૮.૫૦/–** (રૂપિસા પાંસ લાખ સીલેર ઉજાર છસ્શો આઠ અને પસ્શાસ પૈસા પુરા) ૧૮/૦૬/૨૦૨૩ મુજબ) સંધારે સંતોષભ ૦૧/૦૬/૨૦ માંગણાં નોટીસની કંધારે આરતીબેન ગંતોષ લોનની સ્ક્રમ રૂા. ૮,૩૦,૦૦૦/-તારીખ : ૧/૦૬/૨૦ લોન એકાઉન્ટ નંબર 102942000064 **રૂા. ૬,૮૯,૧૫૭.૫૦/–** (રૂપિશા છ લાખ નેવ્સાસી ૦૧/૦૬/૨૦૨ માંગણાં નોટીસની તારીખ : ૨૧/૦૬/૨૦૨: ૧) કશ્યપ સૂજી વકુમાર, ૨) સુનિ . ૧૨ એક્સો સત્તાવન અન્ પસ્શાસ પૈસા પુરા) સંગ્રિવ કશ લોનની ૨કમ રૂા. ૬,૮૪,૦૦૦/-૧૮/૦૬/૨૦૨૩ મુજબ તપીએ તારી લોન એકાઉન્ટ નંપ ર ૧) મારવાડી દક્ષેશકુમાર અશોકકુમાર, ૨) મારવાડી દક્ષાબેન રૂા. ૬,૫૫,૮૮૭.૦૦/-૦૧/૦૬/૨૦ માંગણાં નોટીસની પૈચા છ લાખ પંચાલ આઠસો સીત્યાઝી લોનની સ્ક્રમ રૂા. ૯,૩૨,૭૩૦/ 9८/08/2023 મળબ તારીખ લોન એકાઉન્ટ 31.99,08,303.90/-૧) સંજય કાળુ બેઢેર ૨) રૂનુ સંજય બેઢેરા (રૂપિસા અગીસાર લાખ સાર હજાર સાતસો ત્રણ અને દર પૈસા પુરા) ૧૮/૦૬/૨૦૨૩ માગણા નોટીસની તારીખ : ૨૧/૦૬/૨૦૨ ોનપીએ તાર લોનની ૨કમ રૂા. ૧,૦૩,૦૦,૦૦૦/– લોન એકાઉન્ટ નંબ૨ 152942000355 મુજબ ૧) સોઢા દિપકભાઈ પરસોતમભાઈ, ૨) સોઢા જ્યદિપ દિલીપભાઈ, 3) સોઢા **ફા. ૯,૩૦,૪૯૦.૦૦/–** (રૂપિસા નવ લાખ સીરોસ્ હજાર સારસો નેવું પુરા) ૧૮/૦૬/૨૦૨૩ મુજ્ઞ્બ ાળપાળ આ ૦૧/૦૬/૨૦૨ માંગણાં નોટીસની તારીખ : ૨૧/૦૬/૨૦૨ લોનની ૨કમ રૂા. ૯,૪૦,૦૦૦/-ગીતાબેન દિપ નપીએ તાર લોન એકાઉન્ટ રૂા.૧૫,૦૭,૭૭૮.૮૦/-૧) વકોદરીચ ૦૧/૦૬/૨૦૨ માંગણાં નોટીસની તારીખ : રૂપિ સ્વ,00,002.20)-રૂપિસા પંદર લાખ સાત હજ સાતસો ઈઠ્સોતેર અને ઍસ પૈસા પુરા) ૧૮/૦૬/૨૦૨૩ પ્રવિણભાઈ ભીખુભા ૨) વડોદરીયા દયાળે પ્રવિણભાઈ 524942 લોનની ૨કમ 1. ૧૫,૦૧,૦૦૦/-29/05/203 વ્યીએ તાર લોન એકાઉન્ટ નંપગ **રૂા.૧૪,૬૦,૯૧૭.૮૫/–** (રૂપિચા સૌદ લાખ સાઠી ૧) મોદી ઢેમ નંબર 4269420000916 0979410000102 લોનની સ્ક્રમ રૂા. ૧૪,૧૯,૪૨૦/– રૂા. ૧૨,૯૮૫/– માંગણાં નોટીસની તારીખ : ગીતમભાઈ, ૨) મોદી ારેશકુમાર પ્રેમચંદભાઈ હંજાર નવસો સતર અને પંસ્યાસી પૈસા પુરા) ૧૦/૦૪/૨૦૨૩ મુજબ **રૂા.૧૬,૬૮,૪૩૯.૦૦/–** (રૂપિસા સોળ લાખ અક્સઠ હબ્લર સારસો ઓગણ્સઍર્સ ૨૦/૦૦/૨૦૨ નેનપીએ તારીખ લોન એકાઉન્ટ લોલ સેવાઈન્ટ ગીસે સ્પારટમિલાન - અનુસુધિત મિલાન - મેળે કરાત, વિપ-પુ, અંશવેશર, પ્રાા સંદર્શ કાર્ય કાર્ય સ્પ્રાપ્ય કરે કાર્ય પ્રાય કરે કાર્ય પ્રાય કરતા પ્રાય કરતા પ્રાય કરે કાર્ય કરે કાર્ય કરે કાર્ય પ્રાય કરે કાર્ય કાર્ય કાર્ય કાર્ય પ્રાય કરે કાર્ય કરે કાર્ય કાર્ય કરે કાર્ય કાર્ય કરે કાર્ય કાર્ય કરે કાર્ય પ્રાય કરે કાર્ય પ્રાય કરે કાર્ય કાર્ય કરે કાર્ય કાર્ય કરે કાર્ય કાર્ય કરે કાર્ય કા કાર્ય ૧) રાજા તન્તી, ૨) ૦૩/૦૪/૧૯૫૨ માંગણાં નોટીર ન્યગ્રીબ : મલેશ તન્તી, ૩) ગુકુ તન્તી, ૪) સીતા કુમારી પુરા) ૧૧/૦૫/૨૦૨૩ મુજળ **રૂા. ૧૫,૭૦,૪૬૬.૦૦/**– ૧) ઘંઘાર અંસિતભાઈ પીએ તાર્ટ ૦૩/૦૪/૨૦ નાંગણાં નોર્ટ તારીખ માઈ, ૨) ઘંઘ (રૂપિયા પંદર લાખ સીતેર હજાર સારસો છાસઠ પુરા) વિલાસબેન અંકિતભાઈ ૧૧/૦૫/૨૦૨૩ મુજબ ૧૫/૭૫/૨૦૨: નપીએ તાર્ર **રૂા. ૪,૬૫,૨૬૫.૦૦/–** (રૂપિસા સાર લાખ પાંસ : 03/08/૨૦૨ માંગણાં નોટીસની તારીખ : ૧૫/૦૫/૨૦૨૩ ૧) રામલાલ પ્રભુરામ (રૂપિસા સાર લાખ પાંસઠ હજાર બસ્સો પાંસઠ પુરા) ૧૧/૦૫/૨૦૨૩ મુજ્ઞ ણા, ૨) રચનાકુમારી રામલાલ રાણા ા ગાંધી લોકા અને કે આ ગાંધી વાર્યા પ્રતા છે. આ ગાંધી છે કે અને ગાંધી લાકા પ્રતા છે કે આ ગાંધી છે કે આ ગાંધી છે. આ ગાંધી છે કે આ ગાંધી છે આ ગાંધી છે આ ગાંધી છે કે આ ગાંધી છે આ ગાંધી આગાંધી છે આ ગાંધી છે આ ગાંધી આગાંધી છે આ ગાંધી છે આ ગાંધ ואר ממשמו גמונים/אר-גמונים או

તારીખ : 03.0*3*.૨૦૨૩, સ્થળ : ગુજરાત સહી/– અધિકૃત અધિકારી, જના સ્મોલ કાચનાન્સ બેંક લીમીટેડ વતી

e - 411014